

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૦૯/૨૦૧૭ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૭૭૦/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૨ વ્યક્તિઓને ઝડપી, ૩૪૯ લીટર દેશી દારૂ, ૫૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૩ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ અને ૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૨ કેસ કરી, ૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૯૦૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યાં હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૭૧/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

નજર ચુકવી ચોરી :-

સમાચાર યાદી નં.૧૭૭૨/૧૭

વેજલપુર: પાડલબહેન વા/ઓફ નવિનભાઈ મહેતા (રહે. જય અંબે સોસાયટી વિશ્વામિત્રી સોસાયટી પાછળ જીવરાજ પાર્ક વેજલપુર) તા.૨૯/૮/૧૭ કલાક ૧૦/૦૦ વાગ્યાના સુમારે વેજલપુર વિશ્વામિત્રી સોસા થી પાલડી ધરણીધર જવા માટે શટલ ઓટોરિક્ષામાં બેસી જઈ રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકની મદદગારીથી રિક્ષામાં બેઠેલ ત્રણ પુરૂષોએ પાડલબહેનની નજર ચુકવી પાડલબહેનના ગળામાંથી સોનાનું મંગળસુત્ર કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- ચોરી કરી લીધી હતી. આ અંગેની ફરીયાદ પાડલબહેન મહેતાએ તા.૧/૯/૨૦૧૭ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી સી.એમ ભટ્ટી ચલાવે છે.

કૃષ્ણનગર: તેજસ હસમુખભાઈ પટેલ (રહે.મારૂતિ આમ્રકુંજ ફ્લેટ સરગાસણ ગાંધીનગર) તા.૧/૯/૧૭ સાંજના ૬/૦૦ વાગ્યાના સુમારે વિજય પાર્ક બસ સ્ટેન્ડ નજીકથી પોતાની કાર લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે બે મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષો તેજસ પટેલની નજર ચુકવી કારમંથી લેપટોપ કિંમત રૂપિયા ૧૮,૦૦૦/- અને રોકડ રૂપિયા ૧,૮૬,૦૦૦/- સાથેની બેગ ચોરી કરી લઈ ગયા હતા. આ અંગેની ફરીયાદ તેજસ પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.વી.ખરાડી ચલાવે છે.

લુંટની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૭૭૩/૧૭

રામોલ: હરેન્દ્રપાલસિંહ સ/ઓ ગજેન્દ્રસિંહ જાતે રાહોડ (ઉ.વ.૧૮) (રહે. રાજવંથ પેલેસ રીસોટ રાજપીપળા જી-નર્મદા) એ તા.૧/૮/૧૭ નારોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે હરેન્દ્રપાલસિંહ રાહોડ તથા હરેન્દ્રપાલસિંહના મિત્ર તા.૨૮/૮/૧૭ રાતના ૮/૪૫ વાગ્યાના સુમારે ગતરાડ ગામ તરફ જવાના રોડ ઉપર માટીખાઈ A.M.T.S બસ સ્ટેન્ડની થોડા આગળ જમણી બાજુ કાચા રસ્તા પરથી શટલ ઓટો રિક્ષામાં બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકની મદદગારીથી રિક્ષામાં બેઠેલ એક પુરૂષે હરેન્દ્રસિંહના મિત્રને ચપ્પુ બતાવી તેની પાસે જે કાંઈ હોય તે આપી દેવાનું જણાવી બંને પાસેથી બે લેપટોપ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/-, બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧૬,૫૦૦/- અને રોકડ રૂપિયા ૧૦,૫૦૦/- મેળવી લઈ રિક્ષામાંથી ઉતારી નાસી ગયા હતા આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એચ.બી.બાલીયા ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૭૭૪/૧૭

ગાયકવાડ હવેલી: નનીબહેન હીરાભાઈ પરમાર (ઉ.વ.૮૦) (રહે,હનુમાન વાસ રાયખડ) એ બીમારીથી કંટાળી તા.૩૧/૮/૧૭ કલાક ૧૨/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે કેરોસીન છાંટી સળગી ગયા હતા. સારવાર માટે વા.સા.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તા.૧/૮/૧૭ નારોજ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતુઆ અંગે ગાયકવાડ હવેલી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી કે.એસ.ડામોર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.